

બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૭/૦૫/૨૦૧૮ થી તા.૧૩/૦૫/૨૦૧૮ સુધી)

(૧)

તા.૭/૫/૧૮ના ક.૨૨/૧૫ વાગે મોજે બોડા ચેકપોસ્ટ ખાતે આ કામના આરોપી ટ્રકનં નં.FJ-46-GA-0197 ના ચાલક કિશનલાલ ભીયારામ વિશ્નોઇ રહે. જાખલ તા.સાયોર જી.જાલોર રાજસ્થાન વાળાને ફરસારામ ઉર્ફે પખુ માલારામ વિશ્નોઇ રહે. જાખલ તા.સાયોર જી.જાલોર રાજસ્થાન વાળાએ હરીયાણાથી ટ્રકમાં પરપ્રાંતિય દારૂનો જથ્થો ભરી સાયોર સુધી ટ્રકમાં સાથે આવી સાયોર ઉતરી જઇ ચાલક કિશનલાલને ટ્રક સાથે ગુજરાતમાં રવાના કરતાં નાકાબંધી દરમ્યાન ચાલક કિશનલાલ ગે.કા અને વગર પાસ પરમીટનો પરપ્રાંતિય દારૂનો જથ્થો બોટલ કુલ નંગ.૧૫૩૩૬ કુલ કિ.રૂ.૨૧,૮૧,૬૦૦ તથા ટ્રક કી.રૂ.૧૦,૦૦,૦૦૦ તથા મોબાઇલ-૧ કિ.રૂ.૫૦૦ તથા રોકડ રૂ.૩૩૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૩૧,૮૫,૪૦૦ ના સાથે પકડાઇ જઇ ગુનો કરેલ હોઇ થરાદ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં. ૧૯૩/૧૮ પ્રોહી ક.૬૫એઇ ૮૧ ૯૮(૨) ૯૯ મુજબનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

તા ૦૯/૦૫/૨૦૧૭ ના કલાક ૧૭/૩૦ માજે વેળાવાપુરા ભાટસણ થી સમો જતા રોડ ઉપર આ કામ ના તહોદારો (૧) છોગાજી કાંનાજી માળી રહે.ભોપાનગર માળીવાસ ડીસા તા.ડીસાવાળો તથા (૨) ચતરાજી મજાજી માળી તથા (૩) રમેશભાઇ નારણજી માળી બંને રહે.ભોપાનગર માળીવાસ ડીસા તા.ડીસાવાળાઓ એક બીજાના મેળાપીપણાથી રાજસ્થાન રાજ્યમાંથી ગે.કા. અને વગર પાસ પરમીટનો પરપ્રાંતિય અંગ્રેજી દારૂ/બીયરની બોટલો નંગ-૧૭૨૯ કી.રૂ.૧,૯૫,૩૦૦/- નો તથા સફેદ કલરનું પીકઅપ ડાલું તથા મોબાઇલ નંગ-૦૩ તથા રોકડ રકમ તથા મંડપનો સરસામાન મળી કુલ કિ.રૂ. ૭,૧૫,૫૩૦/- નો મુદામાલ રાખી પકડાઇ જઇ ગુનો કરેલ હોઇ ડીસા રૂરલ પોસ્ટે પ્રોહી ગુ.ર.નં.૨૧૨/૨૦૧૮ ધી.પ્રોહી એક્ટ ક.૬૫એઇ, ૧૧૬(૨), ૮૧, ૮૩,૯૮(૨) મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

તા ૧૦/૦૫/૨૦૧૮ ના કલાક ૧૯/૪૫ મોજે ડીસા બનાસનદીના ડીસા સીટી તરફના પુલના છેડે રોડ ઉપર આ કામ ના તહોદારે પોતાનું મહેન્દ્ર પીક અપ ડાલામાં ગે.કા અને વગર પાસ પરમીટનો પરપ્રાંતિય અંગ્રેજી દારૂ બોટલ નંગ-૩૧૨૦ કી.રૂ.૩,૧૨,૦૦૦/- નો ભરી જે સફેદ કલરનું પીકઅપ ડાલું કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- તથા વિદેશી દારૂ મળી કુલ કિ.રૂ. ૮,૧૨,૦૦૦/- નો મુદામાલ સાથે પોલીસ નાકાબંધી દરમ્યાન ડાલુમુકી નાસી જઇ ગુનો કરેલ હોઇ ડીસા રૂરલ પોસ્ટે પ્રોહી ગુ.ર.નં.૨૧૩/૨૦૧૮ ધી.પ્રોહી એક્ટ ક. ૬૫એઇ,૧૧૬(૨),૯૮(૨) મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૪)

તા.૧૧/૦૫/૨૦૧૮ ક. ૨૧/૦૦ વાગે મોજે આજાવાડા નર્મદા મુખ્ય કેનાલ ઉપર આ કામના તેના કબજા આઇસર ટ્રક નંબર GJ 09 Z 3872 માં ગે.કા અને વગર પાસપરમીટનો પરપ્રાંતિય દારૂ તથા બીયરની કુલ બોટલ/ટીન મળી નંગ ૧૦૫૬૦ નંગ. કિ.રૂ. ૧૦૫૬૦૦૦/-નો ગાડીમાં ભરી ગાડી સાથે કુલ કી.રૂ. ૧૭,૫૬,૦૦૦/ ના મુદામાલ ની હેરાફેરી કરી ગાડી મુકી નાસી જઇ ગુનો કરેલ હોઇ થરાદ પ્રોહી. ગુ.ર.નં. ૧૯૬/૨૦૧૮ પ્રોહી એક્ટ. કલમ ૬૫એઇ, ૯૮(૨), ૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૫)

તા.૧૧/૦૫/૨૦૧૮ ના ક.૧૮/૩૫ વાગે માંજે બલોચપુર ગામની સીમ બનાસ નહેરના કાયા પટમાં આ કામના ટાટા ડંપર નંબર જી.જે.૧૨.એક્ષ.૨૨૯૯ ના ચાલકે તથા તેને મદદગારી કરનાર ઇસમોએ ડંપરમાં ગે.કા અને વગર પાસપરમીટનો પરપ્રાંતિય દારૂ ની કુલ પેટી નંગ - ૪૪૯ જેમાં બોટલ/ટીન નંગ ૧૩૭૮૮ કિ.રૂ. ૨૭૨૧૬૦૦/- નો તથા ટાટા ડંપર સાથે કુલ મુદામાલ ૩૭૨૧૬૦૦/-ની હેરાફેરી કરી પોલીસ રેઇડ દરમ્યાન ડંપરનો ચાલક તથા અન્ય એક ઇસમ ડંપર મુકી ભાગી જઇ ગુનો કરેલ હોઇ શિહોરી પો.સ્ટે. III ગુ.ર.નં.૧૯૦/૨૦૧૮ પ્રોહી એક્ટ ક.૬૫એઇ,૧૧૬(બી),૮૧,૯૮(૨),૯૯ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૬)

૧૨/૦૫/૨૦૧૮ કલાક- ૧૪/૪૦ વાગે મોજે ડીસા પોસ્ટ ઓફીસની બાજુમાં આવેલ હીરાઇસવાના કારખાનાનીચેની ગલીમાં જાહેર માં આ કામના ત્હો નં (૧) યાસીન અબ્બાસભાઇ શેખ રહે. ડીસા સાહીલ સોસાયટી પાવર હાઉસ પાછળ તા.ડીસા વાળો જાહેર માં ગે.કા રીતે વગર પાસ પરમીટે વરલી મટકા ના જુગાર ના આંકડાઓ લખી લખાવી પૈસાથી હારજીત નો જુગાર રમી રમાડી વરલી મટકા ના આંકડાઓ નો જુગાર રમવા ના સાધન સાહિત્ય સાથે તથા રોકડ રકમ રૂ.૧૦,૨૨૦/- મળી કુલ રૂ.૧૦,૨૨૦/- ના મુદામાલ સાથે પકડાઇ ગયેલ હોઇ અને તેઓના મળતીયા નટવર ઉર્ફે ચકો દગુજી ઠાકોર રહે ડીસા નવાવાસ તા.ડીસા વાળાઓ પોલીસ રેઇડ દરમ્યાન નાસી જઇ ગુનો કરેલ હોઇ ડીસા સીટી દક્ષિણ પો.સ્ટે સેકન્ડ ગુ.ર.નં. ૧૨૩/૨૦૧૮ જુગાર ધારા કલમ ૧૨ અ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૭)

તા.૧૨/૫/૧૮ ક.૧૮/૪૦ વાગે મોજે દિયોદર દેલવાડા ફાટક પાસે આ કામે સ્વીફ્ટ ગાડી નં. GJ-05-JE-4851 ના ચાલક ગણપતભાઇ ઇશ્વરભાઇ ઠાકોર રહે.ગોસણ ઠાકોરવાસ તા.ભાભર પોતાની ઉપરોક્ત ગાડીમાં ગે.કા. રીતે પરપ્રાંતિય ઇચ્છીશ દારૂ પેટી નંગ-૬ જેમાં બોટલ નંગ-૨૮૮ કિ.રૂ.૨૮૮૦૦/- ગે.કા.રીતે ભરી હેરાફેરી કરતા પોલીસ નાકાબંધી દરમ્યાન સ્વીફ્ટ ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- સાથે કુલ કિ.રૂ.૩,૨૮,૮૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ ગુનો કરેલ હોઇ દિયોદર પ્રોહી.ગુ.ર.નં.૧૫૯/૧૮ પ્રોહી.ક.૬૫એઇ,૧૧૬(૨),૯૮(૨) મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.